

Regd. Office.: 4th Floor, 1, Laxminagar, Besides Naranpura Post Office, Naranpura, Ahmedabad-380013, Gujarat. (INDIA) Tel.: +91-79-27682700 Email: cs@jayatma.com • Website: www.jayatmaindustries.com • CIN: L17110GJ1983PLC006462

February 07,2025

To,

Department of Corporate Services

BSE Limited

Ground Floor, P. J. Tower,

Dalal Street, Fort,

Mumbai- 400 001

Security ID: JAYIND Security Code: 531323

Sub: Copy of Advertisement of Un-Audited Financial Results for the Quarter Ended on 31st December, 2024

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of Un- Audited Financial Results for the Quarter Ended on December 31, 2024 as per the Regulation 47(1) (b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For, Jayatma Industries Limited

Nirav Kalyanbhai Shah CEO& Director DIN: 00397336

Encl: As above

આણંદ ખાતે નવનિર્મિત ઇપ્કોવાલા ઓડિટોરિચમનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી

(પ્રતિનિધિ)આણંદ, આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ઇપ્કોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે , અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, પુ.ભાઇકાકા જેવી મહાન વિભૃતિઓએ આ વિસ્તારના લોકોના સામાજિક-શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ-સેવાના યજ્ઞના યોગદાનમાં આજે એક છોગુ ઉમેરાયું છે. આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. જે આણંદ, વિદ્યાનગર અને ખેડા જિલ્લાના

નગરજનોને ઉપયોગી સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓડીટોરીયમની બેઠક ક્ષમતા ૧૦૪૭ ની છે, જેનું બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર ર ૬૧૭.૦૫, પ્રથમમાળ ૧૬૯૧.૪૨, બીજોમાળ દરર.૪૬ મળી કુલ ૪૯૩૧.૪૩ ચોરસ મીટર થાય છે તથા ર્પાકિંગ માટે ૨૫૧૨.૫૭ ચોરસ મીટર વિસ્તાર થયેલ છે.

ઓડીટોરીયમમાં ૧૦૦ ફ્રૂટ**x** ૩૦ ફૂટની સાઈઝનું વિશાળ સ્ટેજ ખેનાવવામાં આવેલ છે, જેમાં આધુનિક ઓડીયો સીસ્ટમ, લાઈટ સીસ્ટમ, એક વિશાળ સાઈઝની એલઈડી સ્કીન તથા નાની સાઈઝના બે સ્ક્રીન, સ્ટેજ ફર્નિચર, આધુનિક પુશબેક ખુરશીની



ઑડીટોરીયમમાં જે કોઈ પણ પ્રોગ્રામમાં દરમિયાન આવનાર મહાનુભવો માટે અલગ વીવીઆઈપી રૂમ, મેનેજર રૂમ, પ ગ્રીન રૂમની તથા ડે નંગ લીફ્ટ, આધુનિક ફાયરે ફાઈટીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઓડીટોરીયમના પ્રથમ માળે બાલ્કનીમાં આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.

ઓડીયોરીયમમાં વીજળીનો અવિરત પુરવઠો જળવાઈ રહે તે માટ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બહદ ખેડા જીલ્લામાં આ પ્રકારની ક્ષમતાનું તથા આધુનિક સગવડતા ધરાવતું પ્રથમ ઓડીટોરીયમ છે. જે સરદાર પટેલ રાજમાર્ગ પર હોઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિને ઉપયોગી રહેશે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલે, આગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, નીરવભાઈ અમીન, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિ શ્રીઓ, કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ, પ્રોફેસરશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરામાં કરચોરીની આશંકાએ તેલના વેપારીની દુકાને જીએસટી વિભાગની તપાસ

ગોધરા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આજે સવારથી GST વિભાગની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગના અધિકારીઓએ એક મોટા તેલ વેપારીની દુકાનમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, કરચોરીની આશંકાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.GST વિભાગની ટીમ દ્વારા વેપારીના તમામ વ્યાવસાયિક દસ્તાવેજો, બિલ બુક, સ્ટોક રજિસ્ટર અને અન્ય આનું પંગિક રોડ ચોકી નં. દ ની બાજુમાં મોટાપાયે

આવી રહી છે.

વડોદરા થી આવેલ GST વિભાગ દ્વારા તેલનાં વેપારીના ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ચોકી નં. ૬ ની બાજુમાં ભરત મહેતા ટ્રેડર્સ નામના જથ્થાબંધ તેલના વેપારીના સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. જેના કારણે આજુબાજુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જુવા પામ્યો હતો.ગોધરા શહેરના સ્ટેશન

કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત

કરવામાં આવશે. નવ વિદ્યાર્થીઓને

એકેડેમિક્સમાં ગોલ્ડ મેડલથી

સન્માનિત કરવામાં આવશે, જ્યારે

ત્રણ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સ માટે

ગોલ્ડ મેડલ એનાયત કરીને તેમની

ઉદ્યોગસાહસિક ભાવનાને માન્યતા

આપવામાં આવશે. આ ઉપરાંત,

ચાર વિદ્યાર્થીઓને પીએચ.ડી. માટે

ગોલ્ડ મેડલ આપીને સંશોધન અને

વિકાસમાં તેમણે હાંસલ કરેલી

સિદ્ધિઓને બિરદાવવામાં આવશે.

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ૨૦૨૫નો પદવીદાન સમારંભ ચોજવા માટે સજ્જ થઈ

અમદાવાદ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ

ઇનોવેશન યુનિવર્સિટી જેની ખૂબ જ આતુરતાપૂર્વેક રાહ જોવામાં આવે છે તે પદવીદોન સમારંભને યોજવા માટે સજ્જ થઈ ગઈ છે. ૭ ફેબ્રુઆરીના રોજ સાંજે પ વાગ્યે આ સમારંભ યોજવામાં આવશે. આ ભવ્ય સમારંભ દરમિયાન યુનિવર્સિટીના 9,298 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ડિગ્રીઓ પ્રાપ્ત થશે. ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો), અમદાવાદના ડિરેક્ટર ડૉ. નીલેશભાઈ દેસાઈ તથા ઇન્ડિયન ડ્રગ મેન્યુફ્રેક્ચરર્સ એસોસિયેશન (આઇડીએમએ)ના પ્રેસિડેન્ટ ડૉ. વિરંચી શાહ શાહ પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે

આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કાર્યદેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરીને શૈક્ષણિક અને નવીનીકરણની દ્રષ્ટિએ ઉત્ક્રષ્ટ સિદ્ધિઓ હાંસલ

ઉપસ્થિત રહેર્શે.

ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વીજ ચેક્ટિંગ હાથ ધરવામાં આવ્યું

(પ્રતિનિધિ) ગોંધરા, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં કુલ ૨૬ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કુલ ૫૫૯ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં પ૬ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૯.૩ લાખ જેટલું થાય છે. અને લુણાવાડા તાલુકામાં ૧૦૦ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૧૩ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા પ.૭૫ લાખ જેટલું થાય છે. આમ મહીસાગર જીલ્લાના ખાનપુર અને લુણાવાડા તાલુકાના કુલ ૬૫૯ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ હતા. આ વીજ જોડાણમાંથી કુલ ૬૯ જેટલા વીજ જોડાણોમાં ગેરૅરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧૫.૦૫ લાખ જેટલું થાય છે. આમ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વેસ્ટર્ન ટાઇક્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર



જવા પામ્યો હતો.

હાથ ધરવામાં આવતા મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્ચતાઓ હાલ તો દેખાઈ રહી છે.ગોધરા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ભરત મહેતા ટ્રેડર્સ નામની કપાસ મગફળી તેલના જથ્થાબંધ વેપારીને ત્યાં વડોદરાના જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા મોટાપાયે કરચોરી બહાર આવે એવી શક્ચતાઓ સેવાઈ રહી છે.

ટ્રેડર્સ નામની વેપારીને ત્યાં સર્વેની

કોમગીરી હાથ ધરવામાં આવતા

આજુબાજુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી

જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી

ભરત મહેતા ટ્રેડર્સ નામની દુકાનમાં

ગોધરા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ તેલના વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જે તપાસ હજુ સુધી ચાલુ છે ત્યારે ચાલી રહેલા સર્વેમાં ચોકાવનારા ખુલાસા બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ગોધરાના સ્ટેશન રોડ ઉપર આવેલ ભરત મહેતા ટ્રેડર્સ નામની દુકાનમાં વડોદરાના જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવે – ભાવનગર ડિવિઝન						
	<u>વિવિધ એન્જીનિયરીંગ કામ</u>					
ઈ-ટે-	ન્ડર નં. 215-202	24-25 થી 217-2024-25-R				
ક્રમ નં.	ક્રમ નં ઈ-ટેન્ડર નં. કામનું નામ ટેન્ડર મૂલ્ય (₹) ઈએમડી (₹)					
01	215/2024-25	કાનાલુસ - પોરબંદર સેક્શન :- કિ.મી. 952/1-7 ખાતે વિભાજનોના સ્થળોએ	3,68,82,792.97	3,34,400.00		
25 વોલ સહિત RCC બોક્સ દાખલ કરીને વધારાના દ્વારની જોગવાઈ કરવાનું કામ. બિડિંગ પ્રારંભ થવાની તારીખ: 13/02/2025 અને બંધ થવાની તારીખ: 27/02/2025.						
02	216/2024-25	DEN(E) અધિકારક્ષેત્ર :- (1) ભાવનગર ડિવિઝન : ISD (ડિપ સ્કીનીંગ	4,85,19,564.38	3,92,600.00		
. ભાવનગર હાયા. 130 (ડાય ક્લાપાલ) માં માર્ગ મારા માર્ગ મારા માર્ગ મારા માર્ગ માર્ગ માર્ગ માર્ગ માર્ગ મારા માર્ગ માર્ગ માર્ગ માર્ગ મારા						

અગત્યના પુલો પર TRR(P) - 20.808 Tkm, (4) ધોળા-ભાવનગર ટર્મિનસ, સિહોર-પાલીતાણ અને સાબરમતી-બોટાદ સેક્શન : DEN(E) ના અધિકારક્ષેત્ર હેઠળ થ્રુ વેલ્ડ રિન્યુઅલના મંજૂર થયેલા કામની સામે 3157 નંગ FB વેલ્ડ્સનું વેલ્ડિંગ કરવાનું કામ. **બિડિંગ પ્રારંભ થવાની તારીખ** : 13/02/2025 અને બંધ થવાની તારીખ: 27/02/2025

03	217/2024-25-R	ભાવનગર	ડિવિઝન :	USFD	સાથે	1,06,92,806.40	2,03,500.00
03 217/2024-25-R ભાવનગર ડિવિઝન : USFD સાથે 1,06,92,806.40 2 ,03,500.00 રોજબરોજના USFD પરિક્ષણ કામ માટે 24 મહિનાઓ માટે ટ્રોલી મેન તરીકે કામ કરવા માટે સાથીદારની જોગવાઈ કરવાનું કામ. બિડિંગ પ્રારંભ થવાની તારીખ: 13/02/2025 અને બંધ થવાની તારીખ: 27/02/2025							

NIT **તા.**05/02/2025 ના રોજ રેલવે વેબસાઈટ : <u>www.ireps.gov.in</u> પર અપલોડ કરવામાં આવી છે.

અમને લાશક કરોઃ 🚹 facebook.com/WesternRly • અમને ફોલો કરોઃ 🔀 twitter.com/WesternRly



Ahmedabad Municipal Corporation Mahanagar Seva Sadan Sub Zonal-1 East Zone ENGINEERING DEPARTMENT

E-Tender Notice No:01/2024-25

TENDER FOR ROAD, WATER, DRAINAGE, **BUILDING AND OTHER WORK'S IN EAST ZONE 1-5 ENGINEERING DEPARTMENT**

Submission	Date: 28-02-2025 upto 18.00 hrs.
upto	
Tenders	https://tender.nprocure.com
avialable on	

Dy.MUNICIPAL COMMISSIONER (EAST ZONE)

GUJARAT CRAFT INDUSTRIES LIMITED

[CIN: L25111GJ1984PLC007130] Regd. Off.: 431, Santej-Vadsar Road, Santej - 382 721, Tal.: Kalol, Dist.: Gandhinagar (Gujarat)

UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2024

The Board of Directors in their meeting held on 6th February, 2025 have approved and taken on record the Unaudited Financial Results for the quarter ended on 31st December, 2024 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015.

The aforesaid Unaudited Financial Results for the quarter ended 31st December, 2024 along with Limited Review Report thereon are available on the website of the Company and of BSE Limited at www.bseindia.com and can also be accessed by scanning below Quick Response (QR) Code:



Date: 6th February, 2025

For GUJARAT CRAFT INDUSTRIES LTD. ASHOK CHHAJER

By Order of the Board

CHAIRMAN & MANAGING DIRECTOR (DIN: 00280185)

પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમે ગોમા અને મેસરી નદીમાંથી ગેરકાયદે रेती भनन કरता ७ ट्रेड्टर ઝડप्या

વ્રક્ટર્ય ટાઇમ્સ

રા.૬૦ લાખનો મુદ્દા માલ સીઝ કરાયો

પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદે રેતી ખનનનો

પર્દાફાશ કર્યો છે. વિભાગની ટીમે કાલોલ તાલુકાના ઘુસર ગામ પાસેની ગોમા નદી અને ગોધરા શહેરની મેશરી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા કુલ ૭ ટ્રેક્ટર સાથે રૂા.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કાલોલ તાલુકાના ઘુસર ગામ નજીકની ગોમા નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ઉલેચતા પ ટ્રેક્ટર પકડાયા

(પ્રતિનિધિ) ગોધરા, હતા. જયારે ગોધરા તાલુકાના કંકુથાંભલા વિસ્તાર અને શહેરના મધ્યભાગમાં આવેલી મેશરી નદીમાંથી રેતી ભરીને જતા બે ટ્રેક્ટર ઝડપાયા હતા. ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. વિભાગે જપ્ત કરેલા તમામ વાહનો અને રેતીનો મુદામાલ વેજલપુર પોલીસ સ્ટેશન અને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો છે. હવે આ મામલે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હડકાયા કૂતરાએ પગે અને માથે બચકું ભરતા પાંચ વર્ષીય બાળકનું મોત

(પ્રતિનિધિ) ગોધરા,

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા ૮ વર્ષીય પિયુષ હરીશભાઈ મછારનું કૂતરું કરડ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના અંગે દું:ખ વ્યક્ત કરતાં સંબંધીએ જણાવ્યું હતું કે, સારવાર માટે પ હોસ્પિટલ બદલી પણ પિયુષ બચી શક્યો નહિ. આ ફૂતરાએ પિયુષ સિવાય અન્ય ૧૪ લોકોને પણ બચકાં ભર્યાં હતા.

મળતી માહિતી મુજબ, મૃતક પિયુષના પરિવારમાં માતાપિતા અને એક મોટો ભાઇ છે, જે પાંચમાં ધોરણ અભ્યાસ કરે છે. પિતા હરીશભાઈ રામાભાઈ મછાર ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પિયુષના કાકા દિનેશભાઇના જર્ણાવ્યા મુજબ, અંદાજે ૨૦થી ૨૨ દિવસ પહેલાં શાળાએ જતી વખતે હડકાયા કૂતરાએ પિયુષ પર હુમલો કર્યો હતો, જેમાં તેને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ જ કુતરાએ આસપાસના વિસ્તારમાં અન્ય ૧૪ જેટલા લોકોને પણ બચકાં ભર્યાં હતાં

સારવાર માટે પરિવારજનો સૌપ્રથમ પિયુષને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા, પરંતુ ત્યાં રસી ઉપલબ્ધ ન હતી. જેથી તેને પહેલાં બાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પછી લુણાવાડા સિવિલ હોસ્પિટલ અને છેલ્લે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પિયુષને રસી અને સરવાર આપવામાં આવી હતી. જો કે, બાળકની તબિયત વધુ ખરાબ થતાં અંતે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ૨ દિવસની ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બાકોરથી ૭૦ કિમી દૂર ર્ગોધરા રસી મુકાવી પડી આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાની ખામીઓ ઉજાગર કરી છે.

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative

Retro Bisto,4th Floor, Radhe Icon Complex, Nadiad Petlad Road, Opp Bandhan Party Plot, Nadiad - 387001 Date: 9th February, 2025

Time: 10:30 a.m. Contact Person: Pravin Sumesara (9898018526)

Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow

We look forward to your participation.



TEMPLETON Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor,

Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013 Mutual Fund investments are subject to market risks,

read all scheme related documents carefully

HILLTONE SOFTWARE AND GASES LIMITED

CIN: L72200GJ1993PLC020620 Registered Office: B/4, K B Complex, Dairy Road, Mehsana Gujarat -384002, India . Phone: (02762) 255282 Fax No: (02762) 240055 Email: hilltonegases@yahoo.com Website www.HilltoneGases.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED DECEMBER 31, 2024 (Amt in lacs)

		Quarter Ended		Nine Months Ended		Year Ended
SI.		31.12.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
No.	Particulars	Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited	Audited
1	Total Income from Operations	166.64	151.52	605.45	477.49	732.77
2	Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	9.69	21.17	30.80	34.72	50.64
3	Total Comprehensive Income the period [Comprising for Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	9.69	21.17	30.80	34.72	50.64
4	Equity Share Capital	1093.08	1093.08	1093.08	1093.08	1093.08
5	Earnings Per Share					
	1. Basic:	0.09	0.19	0.28	0.32	0.63
	2. Diluted:	0.09	0.19	0.28	0.32	0.63

Notes:

Place: Mehsana

Date: .07.02.20245

Date : 06 02 2025

Place: Ahmedabad

The above is an extract of the detailed format of the Financial Results for the quarter ended Dec 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the audited financial results are available on the Stock Exchanges websites, http://www.cse-india.com and on the Company's website http://www.hilltonegases.com

For and behalf of Board of Directors **HILLTONE SOFTWARE & GASES LTD** Niket Shah DIN: 00278968 **Managing Director**

JAYATMA INDUSTRIES LIMITED

Regd. office: - 4th Floor, 1, Laxminagar Co-op Hou Soc Ltd. Beside Naranpura Post Office, Naranpura, Ahmedabad 380013 Website:-www.jayatmaindustries.com: Mail:-cs@jayatma.com Ph. No. : - 079 - 22167030 / 40/ 40227000

CIN: L17110GJ1983PLC006462

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER/NINE MONTH ENDED ON 31.12.2024

					(RS. IN LACS)
Sr.			Nine Month Ended		
No.		31-12-2024	30-09-2024	31.12.2023	31.12.2024
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total income from operations (net)	1017.97	257.84	949.45	1690.35
2	Net Profit / (Loss) from ordinary activites before tax,exceptional				
	and/or extra ordinary items	-11.66	-12.71	0.44	-43.95
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or				
	Extraordinary items)	-11.66	-12.71	0.44	-43.95
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or				
	Extraordinary items)	-11.66	-12.71	0.44	-43.95
5	Equity Share Capital	615.30	615.30	615.30	615.30
6	Earning Per Share (In rupees before/after extraordinary items) (of Rs. 10/- each)	_			_
	Basic :	-0.19	-0.21	0.01	-0.71
	Diluted :	-0.19	-0.21	0.01	-0.71

Note: The above is an extract of the detailed format of Standalone Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone Unaudited Financial Results are available on the Company's website i.e. www.jayatmaindustries.com and website of stock exchange i.e. www.bseindia.com.

> By Order of the Board For, JAYATMA INDUSTRIES LIMITED Sd/- Nirav K. Shah (DIN: 00397336)

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો **૬७મો પદવીદાન સમારો**હ ચોજાચો

(પ્રતિનિધિ)આણંદ,

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના ૧૬,૨૧૮ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર પદવીંધારકોને ડીજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

રાજયપાલશ્રીએ પદવીધારકોને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દ્યયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉચ્ચ અર્ને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે



સમાજ્ જીવનના નવા દરવાજા ખુલી રહ્યા છે, તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, દીક્ષાંત એ માત્ર શિક્ષાંત ન બની રહે તેની ચિંતા કરીને વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી

આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે મેળવેલા જ્ઞાનને અંત્યોદય સધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી, રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી, તેમનું જ્ઞાન સમાજ - રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કેં, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ૩,૯૦,૭૬૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે. કાર્યક્રમના

પ્રારંભે

મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે કુલ સચિવ ડો.ભાઈલાલભાઈ પટેલ, પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી સંજય પટેલ, ચોરુતર વિદ્યા મંડળના પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલ, બોર્ડ ઔંક મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીન, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative

Page One Hotel Sandesh Press Rd, Near Premier Apartment, Opposite Avataran Hospital, Vastrapur, Ahmedabad, Gujarat 380015

> Date: 9th February, 2025 Time: 6:30 p.m.

Contact Person: Pravin Sumesara (9898018527) Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow

We look forward to your participation.



Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

> Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative Vivanta,

Akota, Vadodara Date: 9th February, 2025

Time: 6.30 p.m.

Due to limited seats, entry will be provided to registered attendees

only. Please call on the above number to register by tomorrow We look forward to your participation.



Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

> Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully

ફોર્મ નંબર યુઆરસી-૨

અધિનિયમના XXI પ્રકરણના ભાગ I હેઠળ નોંધણી વિશે સૂચના આપતી જાહેરાત. [કંપની અધિનિયમ, 2013 નીકલમ 374(b) અને કંપનીઓના નિયમ 4(1)ને અનુસરીને (નોંધણી માટે અધિકૃત) નિયમો, 2014]

•. આથી સૂચના આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૩૬૬ ની પેટા-કલમ (૨) ના અનુસંધાનમાં, ગુજરાત ખાતેના રજિસ્ટુારને અરજી કરવામાં આવી છે કે M/S શ્રીજી એગ્રી ઇમ્પેક્સ, ભાગીદારી પેઢી રજીસ્ટર થઈ શકે છે. કંપની એક્ટ ૨૦૧૩ ના પ્રકરણ XXI નાભાગ I હેઠળ, શેર દ્વારા મર્યાદિત કંપની તરીકે.

૨. કંપનીના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે :-

(૧) ખાદ્ય અને અખાદ્ય તેલ, તેલીબિયાં, બ્રાન્સના ઉત્પાદન, ઉત્પાદન, વાવેતર, વદ્ધિ, ખેતી, પુનઃ ભરવા, આયાત, નિકાસ, ખરીદી, વેચાણ, પ્રક્રિયા, તૈયાર, ક્રશ અને અન્યથા વેપાર કરવા માટેનો વ્યવસાય ચાલુ રાખવા માટે, એરંડા અને તેલની કોઈપણ પ્રકારની અને કોઈપણ પ્રકારની કેક, જેમાં લીટર, હલએક્સપેલર ઓઈલ કેક, ડી-ઓઈલ્ડ કેક, કઠણ તેલ, વનસ્પતિ ઘી, માર્જિન, ખાદ્ય પ્રોટીન, એરંડાનું તેલ, આલ્કલી રિફાઈન્ડ અળસીનું તેલ, ઔદ્યોગિક તેલ, અળસીનું નિષ્કર્ષણ, કપાસના બીજ, મગફળીનું તેલ, ખાતર મિશ્રણ, હાઇડ્રોજન યુક્ત એરંડા તેલ, તેલ અને ફાર્માસ્યુટિકલ, સીંગ દાજ્ઞાની કેંક, માયરાબોલમ અને બદામના બીજનું તેલ અને ખનિજ તેલ.

(૨) ઉત્પાદન, વેપાર, આયાત, નિકાસ, ખરીદો, વેચાણ, પ્રિઝર્વર્સ, અલગ, પેક, રીપેક, પરિવહન, સ્ટોર, ફોરવર્ડ, વિતરણ, વિકાસ, હેન્ડલ, તૈયાર, ક્રશ, ગ્રાઇન્ડ, મિશ્રણ, પોલિશ તમામ પ્રકારના, જાતો, સ્વરૂપો, કઠોળ, દાળ, દાળ, કઠોળ, અનાજ, ક્ષાર, અનાજ, ગોળ, સૂકા ફળો, દૂધમાંથી ઉત્પાદનો અને અન્ય ડેરી ઉત્પાદનો અને મસાલાઓ સહિત તમામ પ્રકારના સોર્ટેક્સ, સ્વચ્છ, સુધારણા, પ્રક્રિયા અને વ્યવહાર કરો. પરંતુ ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, બાજરી, મગફળીના દાણા, પીનટ બટર, સાબુદાણા, કેરમસીડ, તલ (કાળા અને પીળા) સુધી મર્યાદિત નથી. ધાણા, કેસર, મેથી, એલચી, વરિયાળી, તજ પાવડર, સરસવના દાણા, મરચાં, મરચાંનો પાવડર, મરી, લવિંગ, જીરું, જીરું પાવડર, ધાણા, ધાણા પાવડર, હળદર, હળદર પાવડર, અથાશું, હિંગ, સૂકા આદુનો પાવડર, સૂકા કેરીનો પાવડર, સોનફ, ગાયનુંઘી, ભેંસનુંઘી, દૂધનો પાવડર, ખાંડ, દૂધમાંથી મેળવેલા અન્ય ઉત્પાદનો, તમામ પ્રકારના ગરમ મસાલા, વિવિધ પ્રકારના અન્ય મસાલા, જડીબુટ્ટીઓ, સીઝનીંગ, બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા, જરદાળુ, સૂકા અંજીર, અખરોટ, ક્રેનબેરી, ખજૂર, મખાના (ફોક્સનટ) અને અન્ય તમામ કરિયાણા ઉત્પાદનો અને કૃષિ સંબંધિત ઉત્પાદનો.

(૩) ભારતમાં અથવા અન્ય ખરીદદાર, વિક્રેતા, વેપારી, નિકાસકાર, આયાતકાર, વેપારીઓ, એજન્ટો, ડીલરો, વિતરકો, કમિશન એજન્ટો, દલાલો, સ્ટોકીસ્ટ, પ્રિઝર્વર્સ, ફેક્ટર્સ, કન્સાઇનર્સ, સહયોગીઓ, ફ્રેન્ચાઇઝર્સ, કન્સેશનર, કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય ચાલુ રાખવા માટે , સલાહકારો, ઉત્પાદકો, ઉત્પાદકોના પ્રતિનિધિ, જોબવર્કર, એસેમ્બલર, રિપેરર્સ, ફેસિલિટેટર, ભાડે લેનાર, લીઝ ધારક, ક્લીયરિંગ અને શિપિંગ ફેસિલિટેટર, કસ્ટમ હાઉસ ફેસિલિટેટર્સ, વ્હાર્ફિંગર્સ, ચાર્ટર્સ ભાડે રાખનારા, સુપરિન્ટેન્ડન્ટ્સ, પ્રતિનિધિ, ફેસિલિટેટર અને સર્વિસ પ્રોવાઈડર્સ અને ક્લિયરિંગ સર્વિસ માટે અન્યથા તમામ પ્રકારના, વર્ગો, કદની પ્રકૃતિ અને ઔદ્યોગિક, વ્યાપારી, ઉપભોક્તા કેપિટલ ગુડ્સ, વસ્તુઓ, વસ્તુઓ, લેખો, કોમોડિટીઝ, મર્ચેન્ડાઇઝ, ઉત્પાદનો અને સંલગ્ન પ્રવૃત્તિઓના વર્ણનમાં વ્યવહાર કરો.

a. સૂચિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ ૧ ૨ ૧૬૯, શાકલી માંડલીકપુર રોડ, જુનીશંખલી, ગામ, જેતપુર, રાજકોટ-૩૬૦૩૭૦ ખાતેની ઓફિસમાં તપાસવામાં આવી શકે છે.

<mark>૪. આથી સૂચના આપવામાં આવે છે કે આ અરજી સામે વાંધો ઉઠાવનાર કોઈપણ વ્યક્તિ</mark> પોતાનો વાંધો સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (CRC) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (IICA), પ્લોટ નંબર ૬,૭,૮, સેક્ટર પ ખાતેના રજિસ્ટ્રારને લેખિતમાં જણાવી શકે છે.. IMT. . માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિયાણા), પિનકોડ- ૧૨૨૦૫૦, આ નોટિસના પ્રકાશનની તારીખથી એકવીસ દિવસની અંદર, તેની નોંધાયેલ ઓફિસમાં એક નકલ સાથે. તા.૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ના દિવસે

અરજદારનું નામ : (૧) જગદીશ પાદરીયા (૨) નિ<u>ક</u>ંજ પાદરીયા (૩) ઘનશ્યામ પટોળીયા (૪) દેવરાજ હીરાપરા (૫) અંજનાબેન ગોંડલીયા (૬) વર્મિષ્ઠાબેન પાદરીયા (૭) કિંજલબેન પાદરીયા

Ajax Engineering IPOto open on Monday, February 10, 2025

Ahmedabad, Ajax Engineering Limited (the "Company") proposes to open an initial public offering ("Offer") of its equity share of the face value of Rs. 1 each ("Equity Shares") on Monday, February 10, 2025. The Anchor Investor Bidding Date is one Working Day prior to Bid/Offer Opening Date, being Friday, February 7, 2025. The Bid/ Offer Closing Date is Wednesday, February 12, 2025. The Price Band of the Offer has been fixed from Rs. 599 per Equity Share to Rs. 629 per Equity

Share. Bids can be made for a minimum of 23 Equity Shares and multiples of 23 Equity Shares thereafter. The initial public offering comprises an offer for sale of up to 20,180,446 Equity Shares ("Offered Shares"), consisting of up to 1,716,102 Equity Shares by Krishnaswamy Vijay, up to 1,716,102 Equity Shares by Kalyani Vijay, up to 2,288,136 Equity Shares by Jacob Jiten John, up to 5,593,221 Equity Shares by Jacob Hansen Family Trust, up to 1,430,085 Equity Shares by Susie John uity Shares by Susie John, and up to 7,436,800 Equi-ty Shares by Kedaara Cap-ital Fund II LLP.

The Offer is being made in terms of Rule 19(2)(b) of the SCRR read with Regulation 31 of the

CHANGE OF NAME

have changed my old name from ANKITA MEGHANI to new name KYRA SAHIL AHUJA Add. A-2-6, Harnamdas

Society, Kubernagar Ahmedabad 5087G

CHANGE OF NAME

I have changed my old name from **JIGNABEN** PRAVINCHANDRA MEHTA to new name JIGNA SAGAR BHAVSAR

Add. D6-501, Orchid Legacy, Applewood Township, Shela Ahmedabad 5085

Public Notice

Dr. Deepak Ramchand Balchandani have lost my Doctor of Medicine additional Registration Certificate bearing No. G-2503 (Issued on 10/ 07/1984) during transit. If anybody finds contact on:9913640044or079-22817300 06-02-2025

Place :Ahmedabad.

WESTERN RAILWAY - RAJKOT DIVISION

TRD WORK Notice No. DRM/RJT/E Fender/EL/TRD/2024-2025/19. Date DRM-RJT-EL-TRD-2024-25-19 (i Name of Work: TRD Work connection with improvement reliability of OHE Assets b replacement of leaned OHE structure Rajkot Division. (ii) Approx. Cost: ₹ 73,59,412.21/- Only (iii) Earnest Money: ₹ 1,47,000/- Only (iv) Date and time for on line apply: on 04-03 2025 up to 15:00 Hours. Address of the Office: Divisional Railway Manager (Electrical/Traction) Western Railway, Kothi Compound Rajkot-360 001. Web site particulars:

Follow us on: X twitter.com/West

www.ireps.gov.in

WESTERN RAILWAY - VADODARA DIVISION PROVISION OF DESERT **COOLERS**

Notice Inviting Tender EL/50/1/29(24-25) Dt.05/02/2025 Divisional Railway Manager (Elect), Western Railway, Vadodara Division for and on behalf of the president of India, invites E-Tender on Indian Railways website <u>www.ireps.gov.in</u> from experienced and reliable contractors for the following works Sr. No.1: Tender No. BRC-EL-P. 2393-30-24-25. Name of work Vadodara Division: Provision of deser coolers on hiring basis for a period o three years at various locations stations including filling of water in desert coolers of DRM office, Railway Hospital and PRTN workshop Estimated Cost (Rs.): ₹ 1,11,01,590.60, EMD (Rs.): 2,05,500.00 Tender fees (Rs.): NIL E-Tender closing Date: 26/02/2025 Website particulars www.ireps.gov.in, Office Address Sr. Divisional Electrical Enginee (Power) Vadodara, Western Railway ra-390004

Follow us on: X twitter.com/WesternRly WESTERN RAILWAY - RAJKOT DIVISION

PROVISION OF MEA (MINIMUM ESSENTIAL PASSENGER AMENITIES E-Tender Notice No. DRM-RJT-24 No. DRM-RJT-24-25-SnT-E-16. Dt.05 02-2025. Name of Work: Rajko Division :- Provision of MEA (Minimum Essential Passenger Amenities) in connection with doubling work ov Rajkot division. <u>Tender Cost</u> ₹ 30,87,757.00 (Rs. Thirty Lakh Eight Seven Thousand Seven Hundred Fif Seven only) Earnest Money Deposit ₹ 61,800.00/- (Rs. Sixty One Thousand Eight Hundred Only) **Tender Forn** Fee: ₹ 00.00 (ZERO) As per Para-GCC-July-2022 Last Date and Time for online apply: on Date 27-02-2025 up to 15:30 hours. Address of the Office: Divisional Railway Manager (S&T), Western Railway, Koth Compound, Rajkot-360 001. Website

particular: www.ireps.gov.in



The Offer is being made through the Book Building Process and is in compliance with Regulation 6(1) of the SEBI ICDR Regulations wherein in terms of Regulation 32(1) of the SEBI ICDR Regulations, not more than 50% of the Offer shall be available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs", and such portion, the "QIB Portion") provided that our

CHANGE OF NAME

I have changed my old name from **SALMABANU**

MEHMUDKHAN PATHAN to

new name SALMA

IRFAN BABI

Add. 12 Al Khaibar Duplex

Opp Sonal Cinema Vejalpur,

Ahmedabad

Particulars

(after tax)] **Equity Share Capital**

1. Basic

Diluted

Place: Mehsana

Date:.07.02.20245

WESTERN RAILWAY - AHMEDABAD

ELECTRIFICATION WORK

GS/287/2024-25 (1) Name of work

with its location: Electrification o

Washing cum inspection pit line and

roviding 11/0.433 KV substation fo

lower supply arrangement at Bhu

station in connection with Bhuj-Naliya Gauge conversion Work. (2)

Approx. Cost of the Work: ₹ 2,36,82,103/- (3) Earnest Money to

be deposit: As specified on IREPS portal (4) Date and time of

submission and opening of bid: As specified on IREPS portal (5) Tender

Fee: As specified on IREPS porta

(6) Completion Period of work: 12 Months (7) Website particular

and Notice Board where details

of tender can be seen and

address of the office: Website

www.ireps.gov.in Notice board and

Office of the Dy. Chief Electrical Engineer (Construction), Western

Railway, Nirman Bhavan, Asarva Ahmedabad (Gujarat-382345) CPM-12

Like us on: f facebook.com/WesternRly

No

PARTICULARS

Total income from operations (net)

Net Profit / (Loss) from ordinary

activites before tax exceptional

Net Profit / (Loss) for the period

Net Profit / (Loss) for the period

Earning Per Share (In rupees

before/after extraordinary items)

after tax (after Exceptional and/or

before tax (after Exceptional and/or

and/or extra ordinary items

Extraordinary items)

Extraordinary items)

Equity Share Capital

(of Rs. 10/- each)

Basic

Diluted

www.bseindia.com.

Date : 06.02.2025

Place : Ahmedabad

Total Income from Operations

Total Comprehensive Income

the period [Comprising for

Profit / (Loss) for the period

Net Profit / (Loss) for the

period after tax (after

Extraordinary items)

(after tax) and Other Comprehensive Income

Earnings Per Share

5087B

Company in consultation with the BRLMs, may allocate up to 60% of the QIB Portion to Anchor Investors on a discretionary basis in accordance with the SEBI ICDR Regulations ("Anchor Investor Portion"), of which at least one-third shall be available for allocation to domestic Mutual Funds, subject to valid Bids being received from domestic Mutual Funds at or above the Anchor Investor

CHANGE OF NAME

I have changed my old name from AAESA IBABATKHAN BABI to new name AAYASHABANU IBABATKHAN BABI Add. 12 Al Khaibar Duplex Opp Sonal Cinema Vejalpur Ahmedahad 508

HILLTONE SOFTWARE AND GASES LIMITED

CIN: L72200GJ1993PLC020620 Registered Office: B/4, K B Complex, Dairy Road, Mehsana

Gujarat -384002, India . Phone: (02762) 255282 Fax No: (02762) 240055 Email:

hilltonegases@yahoo.com Website www.HilltoneGases.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED

DECEMBER 31, 2024 (Amt in lacs)

Quarter Ended

Jn-Audited

166.64

9.69

9.69

1093.08

0.09

0.09

Company's website http://www.hilltonegases.com

CHANGE OF NAME

combination of record

high gold prices, and vol-

umes resulted in the high-

est ever total value of de-

Markets Analyst at the World Gold Council, com-mented: "Gold once

again dominated head-lines in 2024, with prices reaching 40 record highs last year. Yet, the demand

Louise Street. Senior

mand at \$382bn.

I have changed my old name from **MAHMMADIRFAN** name IRFAN IBABATKHAN BABI

Year

Ended

31.03.2024

Audited

732.77

50.64

50.64

1093.08

0.63

0.63

Ahmedabad 50874

Nine Months

Ended

Jn-Audited

477.49

34.72

34.72

1093.08

0.32

0.32

For and behalf of Board of Directors

HILLTONE SOFTWARE & GASES LTD

Niket Shah

DIN: 00278968

Managing Director

31.12.2024 31.12.2023 31.12.2024 31.12.2023

Un-Audited Un-Audited

605.45

30.80

30.80

1093.08

0.28

0.28

GUJARAT CRAFT INDUSTRIES LIMITED

[CIN: L25111GJ1984PLC007130]

Regd. Off.: 431, Santej-Vadsar Road, Santej - 382 721,

Tal.: Kalol, Dist.: Gandhinagar (Guiarat)

UNAUDITED STANDALONE FINANCIAL

RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2024

The Board of Directors in their meeting held on 6th February, 2025,

have approved and taken on record the Unaudited Financial

Results for the quarter ended on 31st December, 2024 in terms of

The aforesaid Unaudited Financial Results for the quarter ended

31st December, 2024 along with Limited Review Report thereon

are available on the website of the Company and of BSE Limited

at www.bseindia.com and can also be accessed by scanning

Quarter Ended

31-12-2024 | 30-09-2024 | 31.12.2023

(Unaudited) (Unaudited) (Unaudited)

257.84

-12.71

-12.71

-12.71

615.30

-0.21

-0.21

By Order of the Board

For GUJARAT CRAFT

INDUSTRIES LTD,

ASHOK CHHAJER

CHAIRMAN & MANAGING

DIRECTOR

(DIN: 00280185

949.45

0.44

0.44

0.44

615.30

0.01

Sd/- Nirav K. Shah (DIN: 00397336)

(RS. IN LACS

Nine Month

Ended

31.12.2024

(Unaudited)

1690.35

-43.95

-43.95

-43.95

615.30

-0.71

-0.71

CEO& Director

Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015.

below Quick Response (QR) Code:

Date: 6th February, 2025

JAYATMA INDUSTRIES LIMITED

Regd. office: 4th Floor, 1, Laxminagar Co-op Hou Soc Ltd. Beside Naranpura Post Office,

Naranpura, Ahmedabad 380013

Website:-www.iavatmaindustries.com: Mail:-cs@iavatma.com

Ph. No.: - 079 - 22167030 / 40/ 40227000

CIN: L17110GJ1983PLC006462

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE

THIRD QUARTER/NINE MONTH ENDED ON 31.12.2024

1017.97

-11.66

-11.66

-11.66

615.30

-0.19

-0.19

Note: The above is an extract of the detailed format of Standalone Unaudited Financial

Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of

Standalone Unaudited Financial Results are available on the Company's website

i.e. www.jayatmaindustries.com and website of stock exchange i.e.

Place: Ahmedabad

151.52

21.17

21.17

1093.08

0.19

0.19

The above is an extract of the detailed format of the Financial Results for the quarter ended

Dec 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and

Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the audited financial results are available on the Stock Exchanges websites, http://www.cse-india.com and on the

year-on-year to 1,180t -

banks posting strong de-mand in Q1 before mod-

erating through the middle

of the year and finishing

with a strong Q4. Like-

wise, the second half of

the year saw a notable

resurgence from Western

inveštors which, com-

bined with remarkable

growth in Asian flows,

Бrought global gold ETЃ

flows into positive territory in the third and fourth

quarters. This was fuelled

by the start of rate cutting cycles by many central banks and heightened

global uncertainties, in-cluding the US presiden-tial election and escalat-

ing tensions in the Middle

East. Central banks con-

tinued to buy gold at pace in 2024, with purchases exceeding 1,000t for the

third year in a row. Buy-

ing ramped up significantly in Q4, reaching 333t and bringing the annual

total for central banks to

1,045t. Global investment

demand increased 25%

have changed my old name from NAGORI SHANIYA NAGORI SHANYA AQFEL AHMED

Global gold demand hits new high as prices soar in 2024

Mumbai, The World Gold Council's Q4 and Full Year 2024 Gold Demand Trends report remand Trends report remand Trends report remand to Q1 before model. a four-year high - driven by a révival in gold ETF demand in the second half of 2024. Global gold ETFs added 19t in Q4 2024, marking two consecutive quarters of inflows for the asset class. Bar and coin demand stayed largely in line with 2023 volumes at 1.186t in 2024. Unsurprisingly, high prices dampened demand in the jewellery sector, with annual consumption decreasing by 11% to 1,877t. The decline was driven largely by weak-ness in China (down 24% year-on-year), though In-dian demand remained resilient, dropping just 2% in 2024, in a record high price environment.

CHANGE OF NAME

I have changed my old name from RAKESHKUMAR HASMUKHBHAI MAHERIYA to new nam RAKESHKUMAR

MAHERIYA Add. Maheriya Vas, Devdi-1. Gamdi Daskroi. Ahmedabad

5086

CHANGE OF NAME

Add. 2364, Tahera Manzil,

Shahpur Mill Compound, Shahpur, Ahmedabad

CHANGE OF NAME

I have changed my old name from **NAGOŘI NAŹNINBANU** AKEELAHMED to new name NAGORI NAZNINBANU AQEELAHMED

Add. 2364, Tahera Manzil Shahpur Mill Compound, Shahpur, Ahmedabad

WESTERN RAILWAY - VADODARA DIVISION

APPOINTMENT OF LOCAL AGENTS FOR SALE OF TICKETS Notification No. C171/0/Advt. Vol.VI dtd: 04-02-2025

Applications are invited for appointment of Local Agents for sale of tickets a following stations of Vadodara Division for issuing of unreserved tickets at the Halt stations listed below :-

No.	Station	Section
1	Nartown	Anand - Khambhat
2	Tuwa	Anand - Godhra
3	Bhilupur	Pratap Nagar - Chhota Udepur
4	Thuwavi	Pratap Nagar - Chhota Udepur

uploaded on the web site: www.wr.indianrailways.gov.in 02) Applications should reach this office within 15 (Fifteen) days from publication of this notification in newspapers. 03) Address for detailed information: Sr. Divisional Commercial Manager's, Ground Floor, DRM Office, Pratapnaga

Like us on:

facebook.com/WesternRly • Follow us on:

twitter.com/WesternRly • Follow us on:

twitter.com/WesternRl

ANJAR MUNICIPALITY

ONLINE TENDER NOTICE

In The Concemed Category That Anjar Municipality Has Issued Online Tenders For Following Works.

Construction work of Anjar Municipality sump, esr, pumping machinary, compound wall & pumping room with Operation and Maintenance 5 Years At Vijaynagar And Navanagar Anjar-Kutch. (Amrut 2.0 Swap-(Second Attempt)

The tender for the above works can be downloaded from tender.nprocure.com.The last date for filling the above tender will be:-13/02/2025. The last date for sending the tender document to this office will be till:- 19/02/2025 office time by Speed post/R.P.A.D.Please refer to the above

Important note: Write Tender ID On Physical Tender Document

Date: 06-02-2025

Chief Officer

DDI/KUTCH/1132/2024-25

of Chapter XXI of the Act. [Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorised to

366 of the Companies Act, 2013, an application has been made to the Registrar at Gujarat that M/S SHREEJI AGRI IMPEX, a partnership firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013.

The principal objects of the company are as follows:

cultivate, re-fill, import, export, buy, sell, process, prepare, crush and otherwise dealing in edible and non-edible oils, oilseeds, brans, castor and oil cakes of any nature and kind whatsoever, including linters, hulls expeller oil cakes, de-oiled cakes, hardened oils, Vanaspati ghee margarine, edible proteins, castor oil, alkali refined linseed oil, industria oils, extraction of linseed, cotton seed, groundnut oil, fertilizer mixtures hydrogenated castor oil, oil and pharmaceutical, groundnut cakes, my rabolum and nuts seeds oil and mineral oils

2. To carry on the business of manufacture, trade, import, export, buy sell, preservers, segregate, pack, repack, transport, store, forward distribute, develop, handle, prepare, crush, grind, mix, polish, sortex clean, improve, process and deal in all kinds, varieties, descriptions of beans, dals, lentils, pulses, grains, salts, Cereals Jaggery, dry fruits, products from milk and other- dairy products, and spices including but not limited to wheat, rice, chana, toor dals, millets groundnut kernels, groundnut inshells, peanut butter, sabudana, carom seed, Sesame seeds (black and yellow), coriander seed, saffron fenugreek, cardamom, fennel seeds, cinnamon powder, mustard seeds chilies, chilli powder, pepper, cloves, cumin, cumin powder, coriande coriander powder, turmeric, turmeric powder, pickles, asafoetida, dried ginger powder, dried mango powder, Saunf, cow ghee, buffalo ghee, milk powder, sugar, other products derived from milk, all types of garam masala, different types of other masalas, herbs, seasonings, almonds cashews, raisins, pistachios, apricots, dried fig, walnut, cranberries dates, Makhana (foxnut) and all other grocery products and agri related

3. To carry on the business in India or elsewhere as buyers, sellers merchant, exporter, importer, traders, agents, dealers, distributors commission agents, brokers, stockiest, preservers, factors, consignors collaborators, franchisers, concessionaire, consultants, advisors manufacturers, manufacturers representative, job worker, assembler repairers, facilitators, hirer, leaseholder, clearing and shipping facilitators custom house facilitators, whar fingers, charters hirers, superintendents representative, facilitators & service providers for liaising and clearing service for and otherwise deal in all kinds, classes, size nature and description of industrial, commercial, consumer capital goods, item things, articles, commodities, merchandise, products and allied activities. 3. A copy of the draft memorandum & articles of association of the proposed company may be inspected at the office at 1 2, 169. Shakl

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA) Plot No. 6,7,8, Sector 5, IMT, Manesar, District Gurgaon(Haryana), PIN Code- 122050, within twenty one days from the date of publication of this notice, with a copy at its registered office.

Dated this 6th Day of February, 2025

(4) Devraj Hirapara (5) Anjanaben Gondaliya (6) Dharmishthaben Padariya(7) Kinjalben Padariya

Business Brief |||

Google makes updated Gemini 2.0 Al available to all

New Delhi, Feb 6 (IANS) As the race to build new and better artificial intelligence (AI) models heats up, Google has announced to make the updated Gemini 2.0 Al generally available to all.

Developers can now build production applica-

Developers can now build production applications with Gemini 2.0 Flash. The company is also releasing an experimental version of Gemini 2.0 Pro, its best model yet for coding performance and complex prompts. It is available in Google AI Studio and Vertex AI, and in the Gemini app for Gemini Advanced users. "We're releasing a new model, Gemini 2.0 Flash-Lite, our most cost-efficient model yet in public preview in Google AI Studio model yet, in public preview in Google Al Studio and Vertex Al. Finally, 2.0 Flash Thinking Experimental will be available to Gemini app users in the model dropdown on desktop and mobile," informed Koray Kavukcuoglu, CTO, Google DeepMind, on behalf of the Gemini team. Google said that as the Gemini model family becomes more capable, it will continue to invest in robust measures that enable safe and secure use.

Adani Green Restricted Group 1's outlook revised to 'positive' from 'stable': Crisil

New Delhi, Feb 6 (IANS) Reflecting strong revenue visibility, Crisil Ratings has revised its outlook for long-term bank facilities and non-convertible debentures of Adani Green Restricted Group 1 (RG) to "positive" and reaffirmed the rating at 'Crisil AA+'. 'AGEL RG1' comprises three special purpose vehicles (SPVs) -- namely Adani Green Energy UP Ltd, Prayatna Developers Private Limited and Parampujya Solar Energy Private Limited -- henceforth known as 'AGEL RG1'.

The outlook revision on the group reflects the actual generation being continuously better than the P90 levels and timely refinancing of \$500 million bonds, Crisil said in a note. "Adani Green Restricted Group 1 had better than P90 plant load factor in fiscal 2024 and calendar year 2024 leading to expectations of continued better performance and debt servicing cushions going forward," it said. The rating reflects strong revenue visibility in the form of long-term power purchase agreements at a healthy tariff."These strengths are partially offset by exposure to risks inherent in operating so-lar-energy assets and adverse movement in foreign exchange," according to the note.

The financial risk profile is expected to be

healthy, indicated by a strong debt service coverage ratio through the 18-year tenure of the US senior secured notes, the rating agency said. The liquidity is also supported by a debt service reserve account of six months of debt obligation without any recourse to project assets.

RBI's actions beyond a 25bps rate cut will be more watched: Report

New Delhi, Feb 6 (IANS) While a 25bps rate cut in the upcoming RBI MPC policy is less of a market debate, the actions around "what beyond a cut" will be more watched, a report said on Thursday. Easing by stealth via unconventional policy tools like liquidity and regulatory measures will continue. The RBI may also want to address the stress in the pon-sovereign money market accordstress in the non-sovereign money market, according to a report by Emkay Global Financial Services. "We expect another round of Rs 300 billion Open Market Operations (OMOs), implying Rs 900 billion+ in total in FY25E. A CRR cut is a close call, but a temporary cut may not address the un-derlying banking stress," the report mentioned. Easing in ensuing tighter Liquidity Coverage

Ratio (LCR) norms (April 2025 onwards) and lending stàndards might be a preferred policy tool. We will also watch for additional capital account easing actions via the FCNR route. According to the report, "noisy food inflation" drove a large part of the headline inflation in FY25, while demand slack continued to keep core subdued. However, nearterm food pressures look to be abating with broadbased easing across food categories, and January inflation tracking sub-4.5 per cent (December 5.2 per cent). "Q4FY25E headline inflation is likely to ease to 4.4 per cent vs 5.6 per cent in Q3FY25 supported by strong Kharif output," the report noted. For FY26 as well, inflation on an average will ease to 4.5 per cent vs 4.8 per cent-4.9 per

Indian corporate healthcare sector likely to deliver 15 pc growth in FY26: Report

Mumbai, Feb 6 (IANS) The Indian corporate healthcare sector is likely to deliver around 15 per cent growth (year-on-year) in sales over FY25-FY26, primarily led by growth in average revenue per occu-pied bed (ARPOB) and new bed additions, according to a report on Thursday. India Ratings and Research (Ind-Ra) maintained a neutral outlook for the corporate healthcare sector for FY26, supported by continued robust demand, sustained improvement in profitability, and calibrated enhancement in capacity expansions, which together would lead to a comfortable liquidity position and help sustain the improve-ment in the credit profile. Ind-Ra expects its coverage companies to deliver around 15 per cent YoY growth in sales over FY25-FY26, on account of 5-6 per cent growth in ARPOB, a 100-200bp improvement in occupancy, and 6-8 per cent increase in new bed additions. Indian hospitals have significant growth potential in the near to medium term, driven by an improvement in healthcare infrastructure to meet global standards, the report mentioned. According to Vivek Jain, Director, Corpo-rate Ratings at India Ratings and Research, acquisitions of small hospitals not only boost larger players' financial position and improve economies of scale but also provide growth opportunities for larger chains,

Change of Name JADEJA VINUBA NARSINI

Mother of No 4593476X Rank SEP Name JADEJA ASHOKSINH NARSINH presently residing at Vill -BAMANVAD, PO - BAMANVAD Teh - MODASA, Distt - ARVALLI State - GUJARAT. I have changed my name from JADEJAVINABANARSINH (Old Name) to JADEJA VINÚBA NARSINH (New Name) Affidavit No 719 Dt 5/2/2025

CHANGE OF NAME

have changed my old name from NAGORI AKEEL AHMED BASHIRAHMED to new name NAGORI AQEELAHMED BASHIRAHMED Add. 2364, Tahera Manzil Shahpur Mill Compound.

Shahpur, Ahmedabad

5087E

CHANGE OF NAME have changed my old name

from GOSWAMI MAMATA AKA VRAJBHAMINI to new name GOSWAMI VRAJBHAMINI MADHUSUDAN Add. Goswami Haveli,

oshiwada Ni Pole, Kalupur, Ahmedabad-380001 5071

CHANGE OF NAME

I have changed my old name from NAGORI MOHAMMED SHEHZAN AKEEL AHMED to new name NAGORI MOHAMMED SHEHZAN AQEEL AHMED

Add. 2364, Tahera Manzil Shahpur Mill Compound. Shahpur, Ahmedabad 5087D

mand Trends report reveals that total annual gold demand (including OTC) hit a new, record high of 4,974t, driven by SEBI ICDR Regulations. strong, sustained central bank buying and growth in investment demand. The

Allocation Price.

IBABATKHAN BABI to new Add. 12 Al Khaibar Duplex Opp Sonal Cinema Vejalpur.

KEELAHMED to new name

No.	Station	Section		
1	Nartown	Anand - Khambhat		
2	Tuwa	Anand - Godhra		
3	Bhilupur	Pratap Nagar - Chhota Udepur		
4 Thuwavi		Pratap Nagar - Chhota Udepur		
ote: 01) Eligible candidates should apply as per the details in documents				

it's Here By Informed To The Regesterd Claimants Persons

DETAILS OF WORK **ESTIMATED** AMOUNT

website for more details.

No.3107, Pani, Purvath Branch,

Anjar Municipality

Form No. URC-2

Advertisement giving notice about registration under Part I Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section

as a company limited by shares

1. To carry on the business to manufacture, produce, plant, grow

Mandlikpur Road, Juni Shankali, Village, Jetpur, Rajkot-360370.

By Order of the Board Name(s) of Applicant For, JAYATMA INDUSTRIES LIMITED (1) Jagdish Padariya (2) Nikunj Padariya (3) Ghanashyam Patoliya